



SAR AUTO PRODUCTS LIMITED

Registered Office Address : 50-E, Bhaktinagar Industrial Estate, Rajkot - 360 002. Gujarat (India)

Website : www.sarautoproducsltd.com E-mail : sapl@sarautoproducsltd.com Ph.: +91 281 2374726

CIN No.: L34100GJ1987PLC010088

Date: 14/11/2025

To,
BSE Limited,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai-400001

Sub: Submission of Newspaper Copy -Publication of Un-audited Standalone
Financial Results for the Quarter and half year ended on 30th
September, 2025.

Respected Sir/Madam,

As per Captioned subject and pursuant to Regulation 47 of the SEBI (LODR)
Regulations, 2015, find enclosed herewith copies of un-audited Standalone
Financial Results for the Quarter and half year ended on 30th September,
2025 published in the following Newspapers:

- (1) Free Press Gujarat (English) dated 14th November, 2025
- (2) LOKMITRA (Gujarati) dated 14th November, 2025.

Kindly take the same in your record.

Thanking you.

Yours Sincerely,

For, **SAR AUTO PRODUCTS LIMITED**

Rameshkumar D. Virani
Managing Director
DIN: 00313236



Encl: As above

Indus University Architecture Students Gain Hands-On skills at Shree Hareshwar Saw Mills



AHMEDABAD, In a move to bridge the gap between academic theory and practical industry skills, 40 first-year architecture students from Indus University recently participated in an industry-academia workshop at Shree Hareshwar Saw Mills in Lathi Bazaar, Gita Mandir. The visit provided budding architects with first-hand experience working with timber, plywood, and allied products. Students were accompanied by faculty members Ar. Mitesh Panchal, Ar.

Naitik Vakharia, and Ar. Manushi Gandhi. Rotarian and RMB Member, Mr. Nimish Patel, guided the group, explaining the properties of timber and its role as one of the most versatile and environmentally friendly products available for nation-building. The students also attended a live woodworking workshop where they were shown different techniques and wood finishes, providing them with practical knowledge to apply in their future designs. (19-8)

SNAP 2025 Registration Closing 20th November

Ahmedabad, Symbiosis International (Deemed University) announces the closing of its registration window for the Symbiosis National Aptitude (SNAP) Test 2025 on 20th November. It is a national-level entrance examination for MBA aspirants. With over five decades of academic excellence, Symbiosis remains a top choice for students seeking management education that is globally relevant, industry-aligned, and academically rigorous. There will be no further extension for the application filing date. Aspirants are strongly encouraged to complete their application from process before the deadline. The Computer-Based Test (CBT) will be held on three dates, with candidates allowed to attempt the test up to three times. The best score will be considered for the admission process. The admit cards for the Symbiosis



National Aptitude Test (SNAP) 2025 will be released in phases corresponding to each test date. For SNAP Test 01, the admit card will be available from November 28, 2025 (Friday), and the test will be conducted on December 6, 2025 (Saturday). For SNAP Test 02, the admit card can be downloaded from December 8, 2025 (Monday), while the test is scheduled for December 14, 2025 (Sunday). Similarly, for SNAP Test 03, the admit card will be available from December 15, 2025 (Monday), and the test will be held on December 20, 2025 (Saturday). (20-4)

Advent Hotels International Announces Proposed Listing on NSE & BSE

Ahmedabad, Advent Hotels International Ltd., a marquee owner of luxury and upper-upscale hotels in prime high-demand micro-markets in India, today announced the proposed listing of its equity shares on the National Stock Exchange of India Ltd. (NSE) and BSE Ltd on November 13, 2025.

The listing marks a significant milestone in Advent's journey as a dedicated hospitality platform, enabling enhanced market visibility, liquidity for existing shareholders, and a strengthened capital structure to support future growth. Carved out of Valor Estate Ltd (formerly DB Realty Ltd), Advent Hotels International now operates independently with a focused strategy for

developing, owning, and managing marquee hotel assets across India. The Company is governed by its own Board and Management team following the demerger. "The listing of Advent Hotels International reinforces our commitment to building an institutionally governed and capital-efficient hospitality platform. We are committed to building a lean, operationally excellent hotel platform that is maniacally focused on long-term shareholder value creation. Our goal is to deliver a mid-teens compounded ROE over the next decade or so, through careful acquisitions and disciplined capital allocation," said Mr. Arshad Balwa, Promoter Director, Advent Hotels International Limited. (13-9)

Mirae Asset Mutual Fund launches Mirae Asset Infrastructure Fund

Ahmedabad, Mirae Asset Investment Managers (India) Pvt. Ltd. announces launch of the Mirae Asset Infrastructure Fund, (an open-ended equity scheme following infrastructure theme). The Scheme seeks to invest predominantly in companies that are part of India's infrastructure landscape including construction companies, logistics, power, telecom, building material providers, data centres, healthcare infra and infrastructure financing entities etc. The New Fund Offer (NFO) for the Scheme will open for subscription on November 17, 2025 and close on December 01, 2025. The scheme reopens on December 08, 2025. The minimum initial investment during NFO is ₹5,000 and in multiples of ₹1. The Scheme will be benchmarked against BSE India Infrastructure Total Return Index (TRI). The Scheme will be managed by Ms. Bharti Sawant. India's infrastructure expansion has

entered a multi-decadal super-cycle.

I CAN I WILL FOUNDATION and Unlimited Unnati launched TYCA



Ahmedabad, The I CAN I WILL Foundation and Unlimited Unnati, founded by renowned Business Coach Mr. Shyam Taneja, has announced the launch of its latest initiative TYCA (Transform Yourself – Create Abundance). The launch event took place on 13th November at Unlimited Unnati. The I CAN I WILL Foundation has a clear mission – Build India by helping the MSME sector perform competitively and efficiently. The Foundation works towards enhancing the performance of business owners and their teams by instilling an international level of competitiveness. As Mr. Taneja explains, "By helping Indian entrepreneurs perform better, we aim to make India a power to reckon with." The new initiative, TYCA, has been designed to help participants

work on these areas through a structured process of self-improvement. It focuses on developing leadership qualities through deep introspection, powerful questioning, empathetic listening, and profound thinking. The first TYCA group includes 12-13 dynamic leaders from diverse organizations, who will embark on a year-long journey of growth and transformation. Through this process, participants will engage in thought-provoking discussions that shift perceptions, spark awareness, and inspire meaningful action. "TYCA is not just a forum; it's a journey of self-discovery and collective growth," says Mr. Shyam Taneja. "When we transform ourselves, we create abundance not just for us but for everyone around us." (19-10)

Asian Granito India Ltd Net Profit rise 12 fold to Rs. 15.6 crore in Q2FY26



Ahmedabad, Asian Granito India Limited (AGL), one of the largest Luxury Surfaces and Bathware Solutions brands in the country has turnaround business operation and reported improved operational and financial performance during Q2 and H1 of FY 2025-26 ended 30th September 2025. For H1FY26, company reported consolidated net profit of Rs. 23.2 crore as against net loss of Rs. 1 crore in the corresponding period last year. Net Sales for the H1FY26 rise 8% Y-o-Y to Rs. 795.2 crore as compared to Net sales of Rs. 736.2 crore

in H1FY25. EBITDA for H1 FY26 was reported at Rs. 61.5 crore (EBITDA margin 7.7%), 102% Y-o-Y rise as compared to EBITDA of Rs. 30.5 crore (EBITDA margin 4.1%) in H1FY25. Consolidated Highlights: - Q2FY26 Results - Consolidated Net Sales stood at ₹406.9 crore in Q2FY26, compared to ₹376.1 crore in Q2FY25, reflecting healthy YoY growth. EBITDA increased to ₹36.7 crore with an EBITDA margin of 9.0%, up by 508 bps YoY, as against ₹14.8 crore (3.9% margin) in the corresponding quarter last year. Consolidated Net Profit surged to ₹15.6 crore in Q2FY26, compared to ₹1.2 crore in Q2FY25, marking a strong turnaround in profitability. Exports for Q2FY26 stood at ₹64 crore, reflecting a 17% YoY decline compared to ₹77 crore in Q2FY25. In H1FY26, on the consolidated basis, company has reported a net profit of Rs. 23.2 crore, EBITDA of Rs. 61.5 crore and net sales of Rs. 795.1 crore. (18-2)

FICCI to Organize B2B Meetings in Ahmedabad

Ahmedabad, The Federation of Indian Chambers of Commerce and Industry (FICCI), in collaboration with the Sharjah Airport International Free Zone (SAIF Zone), Government of Sharjah, UAE, is pleased to announce a special series of B2B meetings in Ahmedabad under the theme "Expand Your Business in International Markets through UAE." These meetings will take place on 17 & 18 November 2025 at Hyatt Hotel, Ahmedabad. The initiative will highlight the strategic advantages of the United Arab Emirates as a gateway for Indian companies to tap global opportunities. Special focus

will be on the Sharjah Airport International Free Zone (SAIF Zone), known as one of the most dynamic and investor-friendly free zones in the region. The meetings will provide Indian businesses with direct interaction with SAIF Zone representatives to explore investment prospects, operational support, and the ease of setting up in the UAE. Participants will also gain insights on leveraging the India-UAE Comprehensive Economic Partnership Agreement (CEPA), which grants duty-free access to nearly 97 percent of Indian goods and strengthens India's reach into Africa, Europe and other international markets. (13-9)

One killed, six injured after car overturns near Mogaldham on Bagodara–Bavla highway



Ahmedabad, A road accident occurred early Thursday morning on the Bagodara–Bavla National Highway, near Mogaldham in Gujarat. An Eeco car carrying pilgrims returning to Sabarkantha after visiting Chotila overturned when the driver reportedly lost control of the steering. According to reports, one person died on the spot, while six others sustained serious injuries in the mishap.

Eyewitnesses said the impact of the accident was so severe that the van overturned and veered off the road, landing about 50 metres away. The incident caused panic among commuters on the highway, many of whom rushed to help the victims. Upon receiving information, ambulance teams from Bagodara and Bavla reached the site immediately. The injured were initially taken to Bavla Government Hospital for first aid but were later referred to Sola Civil Hospital in Ahmedabad due to the severity of their injuries.

Meanwhile, a team from the Bavla Police also arrived at the scene. The deceased's body has been sent for post-mortem, and authorities have launched an investigation to determine the exact cause of the accident.

AMC conducts mega demolition drive in Jamalpur after 16 years, razes 30 illegal shops

Ahmedabad, Amdavad Municipal Corporation (AMC) on Monday launched a mega demolition drive in the Jamalpur area, targeting illegal constructions on municipal land near Untwail Chali. Under heavy police deployment, the AMC's estate department demolished around 30 shops, including those allegedly controlled by notorious local operator Bilal Sheikh, who had been illegally occupying and renting out the structures for over 16 years.

According to official sources, Bilal had unauthorisedly taken possession of the municipal property and was collecting rent from shop owners despite having no legal rights over the land. The corporation has planned to continue its operation for the next couple of days to clear over 13,000 square yards of encroached land. The land in question, located in the Lati Bazaar locality of Jamalpur, had originally been leased by AMC to tenants. However, the lease expired in 2009, and no further action was taken by the then deputy estate officer or other officials to reclaim the property.

SYMBOLIC POSSESSION NOTICE
ICICI Bank

Branch Office: ICICI Bank Ltd Office Number 201-B, 2nd Floor, Road No. 1 Plot No-B3, WIFI IT Park, Wagle Industrial Estate, Thane (West)- 400604

The undersigned being the Authorised Officer of ICICI Bank Limited under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) R/W Rule 3 of the Security Interest (Enforcement) rules 2002, issued demand notices upon the borrowers mentioned below, (on the underlying pool assigned to ICICI Bank by Dewan Housing Finance Ltd.) in relation to the enforcement of security with respect to a Housing Loan facility granted, pursuant to a loan agreement entered into between DHFL and the borrower, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken symbolic possession of the property described herein below in the exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of ICICI Bank Limited.

Sr. No.	Name of the Borrower(s)/ Co-Borrower(s) (DHFL Old LAN & ICICI New LAN)	Description of Property/ Date of possession	Date of Demand Notice/ Amount in Demand Notice (₹)	Name of Branch
1.	Nareshbhai Nagjibhai Tailor & Padmaben Nareshbhai Tailor- New ICICI Lan No QZBRD00005030462 & Old DHFL Lan No 01800008207	Flat No. 302, 3rd Floor, Tower-E, Shreeji Kasthbanjan Dev Tower, Sheeji Sadan Villa, R.S. No. 239/5-1, Near Narmad College, Zadeshwar, Bharuch 392002/ November 10, 2025	June 26,2025/ Rs. 4,95,505/-	Vadodra

The above-mentioned borrowers(s)/ guarantors(s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules, 2002.

Date : November 14, 2025
Place : Bharuch

Authorized Officer,
ICICI Bank Limited

Equitas Small Finance Bank Ltd
(FORMERLY KNOWN AS EQUITAS FINANCE LTD)
Corporate Office : No.769, Spencer Plaza, 4th Floor, Phase-II, Anna Salai, Chennai - 600002.
Branch Office: 305-306, 3rd Floor, Abhisree Adroit, Nr. Sunrise Mall, Mansi Circle, Judges Bungalow Road, Bodakdev, Ahmedabad, Gujarat - 380015.

POSSESSION NOTICE
(Rule 8(1) of the Security Interest Enforcement Rules, 2002)
(For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of the EQUITAS SMALL FINANCE BANK LIMITED, Under The Securitization And Reconstruction Of Financial Assets And Enforcement Of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of The Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice Calling Upon the below mentioned Applicant /Borrower/ Co-Applicant/ Co-Borrower/Guarantors/Mortgagors to repay the amount mentioned in the notice With subsequent interest, penal interest, charges, costs etc as per the agreement(s) within 60 days from the date of receipt of the said notice.

The Borrower/ Co-Borrower/ Guarantors/ Mortgagors, having failed to repay the amount, notice is hereby given to the Borrower/ Co-Borrower/ Guarantors/ Mortgagors in particular and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the said Rules.

The Applicant / Borrower/ Co-Applicant/Co-Borrower/Guarantors/ Mortgagors In Particular And The Public In General Is Hereby Cautioned Not To Deal With The Property And Any Dealings With The Property Will Be Subject To The Charge Of Equitas Small Finance Bank Limited. The Applicant / Borrower/ Co-Applicant/Co-Borrower/Guarantors/ Mortgagors attention is invited to provisions of sub- section (8) of Section 13 of the said Act, in respect of time available, to redeem the secured assets.

SR NO	Name of the Borrower(s) / Guarantor(s)	Description of Secured Asset (Immovable Property)	Demand Notice Date and Amount	Date of Possession
1	Loan / Facility Account No. 700007071741/ 700007097255 [1] Mr. Vishvakarma Shivanarayan S/o Mr. Ramprasad, [2] Mrs. Rukmini Devi W/o Mr. Shivanarayan	PROPERTY OWNED BY SHIVNARAYAN RAMPRASAD VISHVAKARMA AND RUKMINIDEVI SHIVNGRAVAN VISHWKARMA Block/Survey No. 142/Paiki 1, City Survey No. NA 142/Paiki 1. Khata No. 1366, Sheet No.NA 99, Total Adm. Hec. 0 77-90, ARE 7790.00 Sq. Mtrs, N.A. Land Paikki," "Vrundavan Villa", Sub Plot No. 12, Total Adm. Area 35.53 Sq.Mrs., And Road And Common Plot Undivided Land Area 39.21 Sq.Mtrs, Total Area 74.74 Sq.Mtrs. Of Mauje Village, Sardar, Taluka & District: Anand, At Registration District & Sub-District Anand & District Anand, Situated Adjacent To The Four Sides Boundaries Of The Property Under Reference. Four Corners Of The Said Property:- East: By Plot No. 11, West: By Plot No. 13, North By R. S. No. 142 Paiki Property & South: By Society Main Road.	25.07.2025 Rs 15,82,618.00/- (Rupees Fifteen Lakh Eighty Two Thousand and Six Hundred Eighteen Only) Due As On 25.07.2025	12.11.2025
2	Loan / Facility Account No. 700006252950 [1] Mr. Valand Jigarkumar Satishbhai S/o Mr. Satishbhai, [2] Mr. Valand Prashant Satishbhai S/o Mr. Satishbhai	RESIDENTIAL PROPERTY OWNED BY MR. VALAND JIGARKUMAR SATISHBHAI All That Pieces And Parcels Of Residential Property Bearing Plot No.38, Area Admeasuring 31.67 Sq. Mtrs. Together With Undivided Share Of Road And Land 23.34 Sq. Mtrs., Total Area Admeasuring 55.01 Sq. Mtrs. In "AADHYA VILLA" Situated On The N.A. Land Bearing R.S. No.2567 Paiki Of Village : Pij, Ta. Vaso & Dist. Kheda And Bounded By : Four Corners Of Said Property:- North : Sub Plot No.14, South : Sub Plot No.37, East: Society Internal Road & West : Banshrivilla Society	30.09.2024 Rs. 17,19,873.83/- (Rupees Seventeen Lakhs Nineteen Thousand Eight Hundred Seventy-Three And Eighty Three Paise Only) Due As On 18.09.2024	12.11.2025

Date - 14.11.2025, Place - Gujarat

Authorized officer, Equitas Small Finance Bank Ltd

Maruti Infrastructure Limited

Extract of Unaudited Financial Results for the Quarter and Half Year ended on 30th September, 2025
(Rs in Lakhs except EPS)

Sr no.	Particulars	Quarter ended		Half Year ended	
		30-09-2025	30-09-2024	30-09-2025	30-09-2024
		Unaudited	Unaudited	Unaudited	Unaudited
1	Total Income from Operations	1,273.58	887.82	2,983.30	1,430.45
2	Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	32.18	(92.70)	63.07	(20.45)
3	Net Profit / (Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	32.18	(92.70)	63.07	(20.45)
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	24.08	(92.52)	51.95	(34.84)
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	24.08	(92.52)	51.95	(34.84)
6	Equity Share Capital	1,875	1875	1,875	1,875
7	Other Equity				
8	Earnings per equity shares				
	Basic:	0.03	(0.10)	0.06	(0.04)
	Diluted:	0.03	(0.10)	0.06	(0.04)

Notes :
1. The above is an extract of the detailed format of Unaudited Financial Results for the quarter and half year ended on 30th September, 2025 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results for the quarter and half year ended on 30th September, 2025 are available on the Stock Exchange website i.e. www.bseindia.com and on the website of the company i.e. www.marutiinfra.in. The same can be accessed by scanning the QR code provided below.

For Maruti Infrastructure Limited
Sd/-
Nimesh D Patel
Chairman & Managing Director
(DIN : 00185400)

Place: Ahmedabad
Date : 12th November, 2025

802, Surmount, Opp. Reliance Mart, Iscon Cross Road, S. G. Highway, Ahmedabad-380015 Phone : 079-40093482
E-mail: maruti_infra@yahoo.com, Website: www.marutiinfra.in
CIN: L45100GJ1994PLC023742

SHANTAI INDUSTRIES LIMITED
CIN: L46411GJ1988PLC013255

Reg Office: Shop 10 2nd Floor, Agrasen Point, Nr Agrasen Bhavan, Citylight Road, Bharthana, Surat, Gujarat, 395007
Website: www.shantaiindustrieslimited.com, Email-id: shantaiindustriesttd@gmail.com, Tel: 0261-2211212

The Standalone Unaudited Financial Results for the quarter and half year ended 30th September, 2025 have been filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone Unaudited Financial Results for the said period is available on the websites of the Stock Exchange(s) at www.bseindia.com and the listed entity at https://shantaiindustrieslimited.com/quarterly-reports/

The Standalone Unaudited Financial Results for the quarter and half year ended 30th September, 2025 have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at their meeting held on 12th November, 2025

For Shantai Industries Limited
Sd/-
HARISHBHAI FATANDAS SAWLANI
Managing Director
DIN: 00831848

Date: 13/11/2025
Place: Surat

SAR AUTO PRODUCTS LIMITED
Regd. Office : 50-E BHAKTINAGAR INDS ESTATE,RAJKOT 360 001
CIN: L34100GJ1987PLC010088
Website: www.sarautoproductsltd.com, Email: sapl@sarautoproductsltd.com

Extract of Unaudited Financial Result for the quarter ended on 30th September, 2025
(Rs.In Lacs except per share data)

Sr. No.	Particulars	Quarter Ended			Half Year Ended		
		30-Sep-25	30-Jun-25	30-Sep-24	30-Sep-25	30-Sep-24	31-Mar-25
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total Income from Operations (net)	241.37	226.94	434.66	468.31	814.36	1,396.79
2	Net Profit/Loss for the period before Tax, Exceptional and Extra Ordinary Items	13.98	11.55	31.53	25.54	61.24	72.89
3	Net Profit/Loss for the period before Tax after Exceptional and Extra Ordinary Items	13.98	11.55	31.53	25.54	61.24	72.89
4	Net Profit/Loss for the period after tax (after Extraordinary Items)	13.98	11.55	31.53	25.54	61.24	41.77
5	Total comprehensive income for the period	14.47	12.16	31.60	26.63	61.58	42.33
6	Paid up Equity Share Capital (Face Value of Share Rs. 10 each)	476.47	476.47	476.47	476.47	476.47	476.47
7	Reserves Excluding Revaluation Reserves	-	-	-	-	-	1,254.45
8	Earnings per Share (EPS) (for continuing operations)	(a) Basic (Not Annualized)	0.29	0.24	0.66	0.54	1.29
	(b) Diluted (Not Annualized)	0.29	0.24	0.66	0.54	1.29	0.88

Note :-
a) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity.
b) The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote.
c) # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.

For and on behalf of Board of Director,
Ramesh D. Virani
Managing Director
DIN : 00313236

Place: Rajkot
Date: November 13, 2025

ઈફકો અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણી એ જોઈનના પ્રધાનમંત્રી શ્રી જાફર હસન સાથે મુલાકાત કરી



અમદાવાદ, ભારત—જોઈન વચ્ચે ખાતર ક્ષેત્રને વધુ મજબૂત દ્વિપક્ષીય સંબંધોની પ્રશંસા કરતા જણાવ્યું કે કૃષિ મજબૂત બનાવવા માટેની મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ઈફકો ક્ષેત્રમાં સહકાર બંને દેશોની અર્થવ્યવસ્થાને નવી દિશા (IFFCO) ના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણી એ જોઈનના આપશે? શ્રી દિલીપ સંઘાણીએ જોઈન સરકારના સહયોગ પ્રધાનમંત્રી શ્રી જાફર હસન સાથે અમાન ખાતે પ્રધાનમંત્રી અને સમર્થન માટે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે ઈફકો અને નિવાસ ખાતે મુલાકાત કરી હતી. આ સીલ્ડર્ટપૂર્ણ મુલાકાત જિફકો (JIFCO) ના સંયુક્ત પ્રયાસોથી આગામી સમયમાં દરમિયાન બંને પક્ષો વચ્ચે ખાતર ઉદ્યોગના વિકાસ, નવીન ખાતર ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ થશે, જેનો સીધો લાભ ટેકનોલોજીનો ઉપયોગ, કૃષિ ઉત્પાદકતા વધારવા અને બંને દેશોના ખેડૂતોને મળશે? આ પ્રસંગે જિફકો (JIFCO) ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા જેવા મુદ્દાઓ પર ના અધ્યક્ષ પ્રો. મહમ્મદ કે. થનેબત, ઈફકો મેનેજિંગ ડિરેક્ટર ચર્ચા થઈ હતી.

પ્રધાનમંત્રી શ્રી જાફર હસને ભારત-જોઈન વચ્ચેના કપૂર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સરકારની ઉદ્યોગસાહસિકતા તાલીમ દ્વારા રાજ્યના આદિજાતિ યુવાનો બની રહ્યા છે આત્મનિર્ભર, છેલ્લા ૪ વર્ષમાં ૧૨૦થી વધુ યુવાનો સફળ ઉદ્યોગસાહસિક બન્યા

ગાંધીનગર એચ.ઓ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશા આદિજાતિ સમુદાય આત્મનિર્ભરતાના પથ પર અગ્રેસર બંને એ સુનિશ્ચિત કર્યું છે. તેમના આ વિઝનને અનુસરીને ગુજરાત સરકાર રાજ્યના આદિજાતિ સમાજના આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે અવિરત પ્રયાસો કરી રહી છે. ગુજરાતના ઉદ્યોગ કમિશનર કાર્યાલય હેઠળ કાર્યરત સેન્ટર ફોર ઓન્ટ્રાપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED ગુજરાત) આદિજાતિ યુવાનોના કૌશલ્ય, રોજગાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે ઘણાં વર્ષોથી ઉદ્યોગસાહસિકતા તાલીમ અને કૌશલ્ય વિકાસની સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે.

૪ વર્ષમાં ૧૦૦૦થી વધુ યુવાનોને ઉદ્યોગસાહસિકતા તાલીમ, ૨ કરોડનો ખર્ચ, ૧૨૦ બન્યા સફળ ઉદ્યોગસાહસિક

છેલ્લા ચાર વર્ષો (૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫)માં ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનર કાર્યાલય હેઠળ કાર્યરત સેન્ટર ફોર ઓન્ટ્રાપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) દ્વારા ૧૪થી વધુ આદિજાતિ જિલ્લાઓમાં ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમ (EDP) અને જીગુતિ માટેના વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેણે હજારો યુવાનોને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની આ વિશેષ પહેલ દ્વારા દર વર્ષે આદિજાતિ વિસ્તારોના લગભગ ૨૦૦થી વધુ યુવાનોને વિવિધ ઉદ્યોગસાહસિકતા સંબંધિત સ્વયંસાધિક તાલીમ આપવામાં આવે છે, જેના કારણે રાજ્યના આદિવાસી જિલ્લાઓના લગભગ ૩૦થી વધુ તાલીમાર્થીઓ સ્વરોજગાર અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યા છે.

છેલ્લા ચાર વર્ષમાં રાજ્ય સરકારે ૨ કરોડ ખર્ચે ૧,૦૦૦થી વધુ આદિજાતિ યુવાનોને ઉદ્યોગસાહસિકતા તાલીમ પૂરી પાડી છે. આમાંથી આત્મનિર્ભર બનેલા ૧૨૦થી વધુ યુવાનો હવે સફળતાપૂર્વક પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે.

તે જ રીતે, કૌશલ્ય વિકાસના પ્રયાસના ભાગરૂપે ૨૦૨૧-૨૨થી ૨૦૨૪-૨૫ દરમિયાન ૧,૩૦૦થી વધુ આદિજાતિ યુવાનોને કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવી હતી. નોંધનીય બાબત એ છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં ૨૨૩ આદિજાતિ યુવાનોને તાલીમ પછી પ્રત્યક્ષ રોજગારની લાંબી મળી છે.

ગુજરાત સરકારના પ્રયાસો સફળ થયા, આદિજાતિ યુવાનોએ દર્શાવ્યું ઉદ્યોગસાહસિકતાનું શક્તિશાળી મોડલ- ગુજરાતમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા તાલીમના કારણે પાયાના સ્તરે પરિવર્તન જોવા મળ્યું છે. વલસાડ જિલ્લાના ગુંડલવ GIDCમાં રહેતા શ્રી હિતેશ પટેલે પણ રાજ્ય સરકારના ઝંઝૂંક થી બિઝનેસ ડેવલપમેન્ટ સંબંધિત તાલીમ મેળવ્યા બાદ સ્ટાન્ડર્ડ ઈકિવપમેન્ટ સંસ્થાની સ્થાપના કરી. રાસાયણિક ઉદ્યોગમાં વપરાતા પ્રોસેસ પંપના નિર્માણમાં તેમની કંપની હવે અગ્રેસર બની ગઈ છે.

આદિત્ય બિરલા ગ્રુપ અને MERCK જેવા હિંગગજ ગ્રાહકો, ૧૫ સભ્યોની ટીમ અને ૩ કરોડનું વાર્ષિક ટર્નઓવર એ દર્શાવે છે કે પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ માટે કૌશલ્ય આધારિત ઉદ્યોગસાહસિકતા કેટલી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

ડાંગના આદિજાતિ વસ્તીના શ્રીમતી દશાબેન બિરાડીએ ઝંઝૂંકની તાલીમ અને સખી મંડળના સહયોગથી અંબિકા હળદર ફાર્મની સ્થાપના કરીને પરંપરાગત હળદરની ખેતીને આધુનિક એગ્રો-બિઝનેસમાં પરિવર્તિત કરી છે. તેમનું વાર્ષિક ટર્નઓવર હવે ૮૦ લાખથી વધુ છે, અને સાથે સ્થાનિક મહિલાઓને રોજગારી પણ આપે છે.

અન્ય એક ઉદાહરણ વડોદરા જિલ્લાના વાઘોડિયાના રહેવાસી શ્રી તરુણ વસાવાનું છે, જેમણે JSP પ્લાસ્ટિક્સના માધ્યમથી પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્રમાં મજબૂત ઓળખ સ્થાપિત કરી છે. ૧૫ લોકોને રોજગાર આપતા તેમના યુનિટનું વર્તમાન વાર્ષિક ટર્નઓવર લગભગ ૧ કરોડનું છે, અને હવે તેઓ સૌર ઊર્જા ઈન્સ્ટોલેશનના નવા વ્યવસાય સાથે પોતાના સાહસને વિસ્તૃત કરી રહ્યા છે. તો અરવલ્લી જિલ્લાના મેઘરજના શ્રીમતી જયાબેન વરસતે ગુજરાત સરકારના CEDમાંથી તાલીમ લીધા બાદ જયશ્રી ઓર્ગેનિક ગુલુ ઉદ્યોગની સ્થાપના કરી છે. આજે તેઓ ૨૫ લોકોને રોજગારી આપીને શ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકતાનું શક્તિશાળી મોડલ રજૂ કરી રહ્યા છે.

આદિજાતિ સમુદાયના આર્થિક સશક્તિકરણ માટે ગુજરાતનું ઉદ્યોગસાહસિકતા તાલીમ મોડલ શું છે? ગુજરાત સરકારના ઉદ્યોગસાહસિકતા તાલીમ મોડલમાં ૪૨ સ્કિલ અપ-ગ્રેડેશન સેન્ટર્સ, એન્ટર ઈન્સ્ટિટ્યૂટ્સ, ઉદ્યોગ-આધારિત બ્રિજ અભ્યાસક્રમો અને સ્પેશ્યલાઈઝ્ડ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનો સમાવેશ થાય છે. આધુનિક સાધનો, સ્માર્ટ વર્ગખંડો અને સ્થાનિક ઉદ્યોગો સાથેની ભાગીદારી દ્વારા આ કેન્દ્રોને એટલા સક્ષમ બનાવવામાં આવ્યા છે કે તાલીમ ઉદ્યોગસાહસિકતા અને રોજગારીમાં પરિવર્તિત થઈ શકે.

અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે ટુ-વ્હીલર ચાલકનું કમકમાટીભર્યું મોત, એકને ઈજા

અમદાવાદ, અમદાવાદ શહેરના માર્ગો પર બેફામ ડ્રાઇવિંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઓઢેવ રિંગ રોડ બ્રિજ નીચે રવિવારે મોડી રાત્રે એક અજાણ્યા પૂરપાટ ઝડપે આવતા વાહને ટુ-વ્હીલરને ટક્કર મારતા ૪૫ વર્ષીય ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઓઢેવ ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર આ દુઃખદ ઘટના રવિવારે રાત્રે આશરે ૧૧:૪૫ વાગ્યે બની હતી. મૃતકની ઓળખ ગોવિંદ પરમાર (ઉંમર ૪૫) તરીકે થઈ છે, જેઓ શૈલેષ પરમાર સાથે ટુ-વ્હીલર પર સવાર હતા. જ્યારે તેઓ ઓઢેવ રિંગ રોડ ઈન્ટરસેક્શન બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા વાહને પાછળથી તેમના ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને સવાર ટુ-વ્હીલર પરથી ફંગોળાઈ ગયા હતા.

ગોવિંદ પરમારને ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. જ્યારે શૈલેષ પરમારને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સર્જનાર વાહન ચાલક અંધારાનો લાભ ઉઠાવી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ મામલે મૃતકના સંબંધી અને ઓઢેવના રહેવાસી મહેશભાઈ પરમાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એક વરિષ્ઠ ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'અમે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ હિટ એન્ડ રન કેસમાં વાહનની ઓળખ કરવા માટે આસપાસના વિસ્તારના તેમજ નજીકના ટોલ પોઈન્ટના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
Central Bank of India

૧૪ નવેમ્બર, ૨૦૨૫ નાં રોજ આયોજિત મેગા કૃષિ કેડિટ આઉટરીચ કાર્યક્રમ

માં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, મરઘાં ઉછેર થી સૌર ઊર્જા સુધી, દરેક કૃષિ સપનાં ને અનુકૂળ વિત્તીય સેવાઓ પુરી પાડે છે.

સેન્ટ પોલ્ટ્રી યોજના

- મરઘાં પાલન વ્યવસાયની સ્થાપના અને વિસ્તરણ
- વ્યાજ દર ૮.૩૫% થી શરૂ
- ₹૫૦ કરોડ સુધી લોન

સેન્ટ ફુડ પ્રોસેસીંગ પ્લસ યોજના

- ચોખા, તેલ, દાળ, દુધ અને અન્ય પ્રોસેસીંગ યુનિટ માટે યોજના
- વ્યાજ દર ૭.૮૫% થી શરૂ
- ₹૧૦૦ કરોડ સુધી લોન

સેન્ટ કોલ્ડ સ્ટોરેજ યોજના

- કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ સ્થાપના માટે ફાઈનાન્સ
- વ્યાજ દર ૭.૮૫% થી શરૂ
- ₹૫૦ કરોડ સુધી લોન

સેન્ટ SHG - NRLM યોજના

- રિવોલ્વીંગ કેશ કેડિટ અને ટર્મ લોન સપોર્ટ
- વ્યાજ દર ૮.૦૦% થી શરૂ
- ₹૨૦ લાખ સુધી લોન

સેન્ટ સોલાર - પીએમ કુસુમ યોજના

- ૨ મેગા વોટ સુધી સોલાર પ્લાન્ટ્સ માટે ફાઈનાન્સ
- વ્યાજ દર ૮.૦૦% થી શરૂ
- ₹૧૦ કરોડ સુધી લોન

તમારી દરેક કૃષિ જરૂરીયાત માટે પ્રાપ્ત કરો - આસાન અને સુલભ લોન. વધુ માહિતી માટે આપની નજીકની શાખા, ક્ષેત્રીય કાર્યાલય અથવા અંચલ કાર્યાલયનો સંપર્ક કરો.

Give us a Miss call for Loan Assistance **922 390 1111** Toll Free Number **1800 30 30** WhatsApp Number **7900 123 123** *નિયમો અને શરતો લાગુ. **www.centralbank.in.in**

MEHTA SECURITIES LIMITED

CIN: L67120GJ1994PLC022740

Reg. Off: 2, Law Garden Apartment, Scheme-1, Opp. Law Garden, Ellisbridge, Ahmedabad - 380006
E-mail: mehtasec@gmail.com | Website: www.mehtasecurities.com
Ph: +91 9377578519

Extract of Statement of Standalone Unaudited Financial Results for the Quarter and Half year ended 30/09/ 2025 (Rs. In Lakhs except EPS)

Sr. No.	Particulars	Quarter ended 30/09/ 2025 (Unaudited)	Quarter ended 30/09/2024 (Unaudited)	Half Year ended 30/09/2025 (Unaudited)	Year ended 31/03/2025 (Audited)
1	Total Income from operation(Net)	13.20	14.04	18.64	45.41
2	Net profit / (loss) for the period (before tax, exceptional and /or extraordinary items)	5.82	7.81	-0.74	15.84
3	Net profit / (loss) for the period before tax (after exceptional and /or extraordinary items)	5.82	7.81	-0.74	15.84
4	Net profit / (loss) for the period after tax(after exceptional and /or extraordinary items)	5.82	7.81	-0.74	15.84
5	Total Comprehensive Income for the period comprising Profit(Loss) and Other Comprehensive Income for the period (after tax)	5.82	7.81	-0.74	15.84
6	Paid up Equity Share Capital(Rs.10/- each)	308.94	308.94	308.94	308.94
7	Other Equity				245.18
8	Earning per share (Rs. 10/-each) Basic and Diluted	0.19	0.25	-0.024	0.51

Notes:

(1)The above is an extract of the detailed format of Unaudited Financial Results for the Quarter and Half Year ended 30/09/2025 filed with Stock Exchange under Regulation 33 of the SEBI(Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015.

(2)The full format of the same alongwith the notes is available on the website of Stock Exchange at www.bseindia.com and at the website of the Company at www.mehtasecurities.com

For, Mehta Securities Limited
SD/-
Bhavna D. Mehta
Chairperson & Managing Director
(DIN:01590958)

Place: Ahmedabad
Date : 13-11-2025

LARSEN & TOUBRO LIMITED

Regd.Office of the Company: L & T House, Ballard Estate, Narottam Morarjee Marg, Mumbai, Maharashtra, 400001

Notice is hereby given that the certificate(s) for the mentioned securities of the Company have been lost/misplaced and the holder(s) of the said securities have applied to the Company.

Any person who has claim in respect of the said securities should lodge such claim with the company at its Registered Office with in 15 days from this date, else the company will proceed to issue duplicate share certificate(s) without further intimation.

Name of the Holder	Folio No.	Kind of securities & Face value	No. Of Securities	Distinctive Nos.	Certificate Nos.
SHETH SHANTILAL KESHAVALAL	70395134	Equity Shares Face Value of Rs.2/- each	145	5778262 -5778406	111153
SHETH SHANTILAL KESHAVALAL	70395134	Equity Shares Face Value of Rs.2/- each	145	143764082 -143764226	259187
SHETH SHANTILAL KESHAVALAL	70395134	Equity Shares Face Value of Rs.2/- each	290	579754034 -579754323	374875
SHETH SHANTILAL KESHAVALAL	70395134	Equity Shares Face Value of Rs.2/- each	290	620786676 -620786965	466373

Place: Halol
Date: 13-11-2025

માસ સુરલ હાઉસિંગ અને મોર્ટેગેજ ફાઈનાન્સ લિમિટેડ

રજીસ્ટર્ડ ઓફિસ: ૪થો માળ, નારાયણ ચેમ્બર્સ, પતંગે હાઉસ પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૦૮.

શાખા બંધ કરવાની સૂચના

ખાસ કરીને દેવાદારો અને સામાન્ય રીતે જાહેર જનતાને આથી સુચિત કરવામાં આવે છે કે કંપનીની શાખા કચેરી, ટી-૮, રાધા આકેડેમી, ઈન્દિરા સ્ટેચ્યુ પાસે, તાલુકા: આણંદ, જિલ્લા આણંદ, જિલ્લા પછી બંધ થવા જઈ રહ્યું છે અને નવી શાખાનું સરનામું ૧૦૦૭, ૧લો માળ, નારાયણ એમ્પાયર, પંચાલ હાલ પાસે, આણંદ-૩૮૮૦૦૧ રહેશે.

જો ૩ મહિના પછી પણ બંધ ન થાય, તો અલગથી જાણ કરવામાં આવશે. વધુ વિગતો માટે કૃપા કરીને ૦૭૯ ૬૮૨૭૪૧૦૦ / manish_dave@mas.co.in પર સંપર્ક કરો.

માસ સુરલ હાઉસિંગ અને મોર્ટેગેજ ફાઇનાન્સ લિમિટેડ વતી

સહી/-
અધિકૃત અધિકારી
તારીખ: ૧૪.૧૧. ૨૦૨૫

SHANTAI INDUSTRIES LIMITED

CIN: L46411GJ1988PLC013255

Reg Office: Shop 10 2nd Floor, Agrasen Point, Nr Agrasen Bhavan, Citylight Road, Bharthana, Surat, Gujarat, 395007

Website: www.shantaiindustrieslimited.com, Email-id: shantaiindustriesdtr@gmail.com, Tel: 0261-22111212

The Standalone Unaudited Financial Results for the quarter and half year ended 30th September, 2025 have been filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone Unaudited Financial Results for the said period is available on the websites of the Stock Exchange(s) at www.bseindia.com and the listed entity at https://shantaiindustrieslimited.com/quarterly-reports/

The Standalone Unaudited Financial Results for the quarter and half year ended 30th September, 2025 have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at their meeting held on 12th November, 2025

For Shantai Industries Limited
Sd/-
HARISHBHAI FATANDAS SAWLANI
Managing Director
DIN: 00831848

Date: 13/11/2025
Place: Surat